



ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

રાજીવ ગાંધી ભવન, સંસ્કાર કેન્દ્ર માર્ગ, એલિસબ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬.

ફોન : ૦૭૯-૨૬૫૭૮૨૧૨ - ૨૧૩, ફેક્સ : ૨૬૫૭૮૫૮૯

Web : www.gujaratcongress.org • E-mail ID : gpcc1234@gmail.com

અખબારી યાદી

તા. ૩૦-૦૯-૨૦૧૭

ભાજપ સરકારના મંત્રીશ્રી વલ્લભભાઈ કાકડિયાના કાર્યાલયમાં ભાજપની વિસ્તારકો માટેની કીટ-પ્રચાર સામગ્રી વિદ્યાનિકેતન શાળા, ખોડીયારનગરમાં અભ્યાસ કરતાં નાના બાળકો પાસે તૈયાર કરવાની બાળ મજદુરી ઘટનાનો વિડીયો જે વાયરલ થયો તેના પરથી ભાજપની અને મંત્રીશ્રીની બાળકો પાસેની મજુરીના દ્રશ્યો સ્પષ્ટ થાય છે. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં બાળ મજુરી કરવી કે કરાવવી કાયદાકીય રીતે ફોજદારી ગુન્હો છે. ત્યારે ભાજપના મંત્રીશ્રી દ્વારા શાળાના ગણવેશ સાથેના બાળકો પાસે બાળ મજુરી અંગે તાત્કાલિક ફોજદારી ગુન્હો દાખલ કરવા અને ભાજપના મંત્રીમાં શરમ હોય તો રાજીનામું આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની કરની અને કથનીમાં મોટું અંતર છે. બાળકો પાસે મજદુરી કરાવવાના દ્રશ્યોથી સ્પષ્ટ થાય છે કે, બાળ મજદુરી કાયદાનું પાલન કરાવવાને બદલે ભાજપ સરકારના મંત્રીઓ જ કાયદાના સંદંતર ધજ્જયા ઉડાડી રહ્યા છે. ભાજપ સરકારના મંત્રીનો આ વિડીયો જ સાબિતી છે કે, ગુજરાતમાં બાળ મજુરી રોકવા માટે ભાજપ સરકાર ગંભીર નથી. શાળાના ગણવેશ સાથે વિદ્યાર્થીઓ વિડીયોમાં દેખાય છે, તે પરથી એ પણ સ્પષ્ટ છે કે, બાળકોનો શિક્ષણનો અધિકાર પણ છીનવાઈ રહ્યો છે. શાળાના બાળકો પાસે ભાજપની પ્રચાર સામગ્રીની કીટ તૈયાર કરવાની બાળ મજદુરી ઘણી જ ગંભીર બાબત છે. આ દ્રશ્યો જ બતાવે છે કે, ભાજપ સરકારના મંત્રીઓ કેટલી હદ સુધી નીચે જઈને દેશના ભવિષ્ય એવા બાળકોનું બાળપણ અને શિક્ષણનો અધિકાર છીનવી રહ્યા છે.

શાળાના બાળકો પાસે બાળ મજદુરીનો વિડીયો અંગે ભાજપના મંત્રીશ્રી સામે ફોજદારી ગુન્હો દાખલ થાય અને ભાજપ સરકારમાં થોડી પણ શરમ હોય અને બાળ મજદુરી રોકવા માટે પ્રતિબદ્ધ હોય તો મંત્રીશ્રી વલ્લભભાઈ કાકડિયાની મંત્રી મંડળમાંથી હકાલપટ્ટી કરવામાં આવે.

(ડૉ.મનીષ એમ.દોશી)

પ્રવક્તા

નોંધ: આ સાથે ભાજપની વિસ્તારકો માટેની કીટ-પ્રચાર સામગ્રી વિદ્યાનિકેતન શાળા, ખોડીયારનગરમાં અભ્યાસ કરતાં નાના બાળકો પાસે તૈયાર કરવાની બાળ મજદુરી ઘટનાનો વિડીયો સામેલ છે.